

અવધી વસિયતના કે વિદે નવહાલો આ વાકીલ મુસલમા



وَصَايَا إِمَامِ آعْظَمَ

અવધી વાકીલ

ઈમામે આ'અમ ડી વસિયતે

IMAME AZAM KI VASIYATEIN (GUJARATI)

અવધી વાકીલના વસિયતના, વિદે નવહાલોના વસિયતના

ઈમામે આ'અમ અબૂ હનીફા નો'માન બિન સાબિત અવધી વાકીલ

અલ મુ-તવફફા 150 રિ.



کتابخانه
SC1288

کتابخانه
(SC1288)

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 مَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કિતાબ પઢને ઠી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી
 હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર
 કાદિરી ૨-ઝવી ઝિયાઈ دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ

દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ
 દુઆ પઢ લીજિયે بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ જો કુછ પઢેગે યાદ રહેગા. દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ
 عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તર્જમા : ઐ અલ્લાહ عَزَّوَجَلَّ ! હમ પર ઈલ્મો હિકમત કે દરવાઝે ખોલ દે
 ઐર હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઐર બુઝુર્ગી
 વાલે ! (المستطرف ج ١ ص ٤٠٤ دارالفکر بيروت)

નોટ : અવ્વલ આખિર એક બાર દુરૂદ શરીફ પઢ લીજિયે.



તાલિબે ગમે મદીના
 બકીઅ
 વ મગ્ફિરત

13 શવ્વાલુલ મુકર્રમ 1428

अरबी तरबिख्यत के लिये नसीहतों का म-दनी गुलदस्ता

وَصَايَا إِمَامٍ أَعْظَمَ ﷺ

तरजमा बनाम

ઈમામે આ'ઝમ رضی اللہ تعالیٰ عنہ કી વસિયતે

ઈમામુલ અઈમ્મા, સિરાજુલ ઉમ્મહ

ઈમામે આ'ઝમ અબૂ હનીફા નો'માન બિન સાબિત رضی اللہ تعالیٰ عنہ

અલ મુ-તવફફા 150 હિ.

પેશકશ : મજલિસે અલ મદી-નતુલ ઈલ્મિયા (દા'વતે ઈસ્લામી)

શો'બએ તરાજિમે કુતુબ

: નાશિર :

મક-ત-બતુલ મદીના અહમદ આબાદ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

નામ કિતાબ	:	વસાયા ઈમામે આ'ઝમ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ
તરજમા	:	ઈમામે આ'ઝમ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કી વસિયતે
મુસન્નિફ	:	ઈમામુલ અઈમ્મા ઈમામે આ'ઝમ અબૂ હનીફા નો'માન બિન સાબિત
મુતર્જિમીન	:	મ-દની ઉ-લમા (શો'બએ તરાજિમે કુતુબ)
સિને તબાઅત	:	૨-મઝાનુલ મુબારક, 1431 સિ. હી.

તસ્દીક નામા

તારીખ : 9 રબી'ઉન્નૂર 1430 હિ. હવાલા નમ્બર : 156

الحمد لله رب العلمين والصلوة والسلام على سيد المرسلين وعلى آله واصحابه اجمعين

તસ્દીક કી જાતી હૈ કે કિતાબ “વસાયા ઈમામે આ'ઝમ” કે

તરજમા “ઈમામે આ'ઝમ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કી વસિયતે”

(મત્બૂઆ મક-ત-બતુલ મદીના) પર મજલિસે તફ્તીશે કુતુબો રસાઈલ કી જાનિબ સે નઝર સાની કી કોશિશ કી ગઈ હૈ. મજલિસ ને ઈસે મતાલિબ વ મફાહીમ કે એ'તિબાર સે મકદૂર ભર મુલા-હઝા કર લિયા હૈ, અલબત્તા કમ્પોઝિંગ યા કિતાબત કી ગ-લતિયોં કા ઝિમ્મા મજલિસ પર નહીં.

મજલિસે તફ્તીશે કુતુબો રસાઈલ
 (દા'વતે ઈસ્લામી)

07-03-2009

પહલે ઈસે પઢિયે !

ઈમામુલ અઈમ્મા, સિરાજુલ ઉમ્મહ હઝરતે સચ્ચિદુના ઈમામે આ'ઝમ અબૂ હનીફા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ને અપને શાગિર્દો કો ઈન્તિહાઈ મુફીદ નસીહતેં ફરમાઈ જો મુખ્તલિફ કુતુબ મેં બિખરી હુઈ થીં. اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ ! મજલિસે અલ મદી-નતુલ ઈલ્મિય્યા કે હુકમ પર શો'બએ તરાજિમે કુતુબ કે મ-દની ઉ-લમા رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمْ ને અનથક કોશિશ સે ઈન નસીહતોં કો ચકજા કર કે ઈન કા ઉર્દૂ તરજમા પેશ કરને કી સઆદત હાસિલ કી હૈ. યેહ રિસાલા હઝરતે સચ્ચિદુના ઈમામ અબૂ યૂસુફ, હઝરતે સચ્ચિદુના યૂસુફ બિન ખાલિદ બસરી, ઈમામે આ'ઝમ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કે શહજાદે હઝરતે સચ્ચિદુના હમ્માદ, હઝરતે સચ્ચિદુના નૂહ બિન અબી મરયમ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمْ عَلَيْهِمْ أَجْمَعِينَ વગૈરા અકાબિર તલામિઝા કો, કી ગઈ નસીહતોં પર મુશ્તમિલ હૈ જો ઈન્સાન કી ઝાહિરી વ બાતિની દુરુસ્તી કે લિયે ઈન્તિહાઈ મુફીદ હૈં. ઈસ મેં ઈસ્લાહ કે બે શુમાર મ-દની ફૂલ હૈં. મ-સલન અલ્લાહ عَزَّوَجَلَّ સે ડરતે રહના, અવામ વ ખવાસ કી અમાનતેં અદા કરના, ઉન્હેં નસીહત કરના, બાદશાહે વક્ત કે સામને ભી હક બયાન કરના, ઝિયાદા હંસને સે બચના, તિલાવતે કુરઆને પાક કી પાબન્દી કરના ઓર અપને પડોસી કી પર્દા પોશી કરના વગૈરા. અલ્લાહ عَزَّوَجَلَّ 'વતે ઈસ્લામી કી તમામ મજલિસ બ શુમૂલ "અલ મદી-નતુલ ઈલ્મિય્યા" કો દિન ગ્યારહવીં રાત બારહવીં તરક્કી અતા ફરમાએ.

(امین بجاء النبی الامین صلوات اللہ تعالیٰ علیہ وسلم)

इंडरिस्त

मउमून	संख्या नम्बर	मउमून	संख्या नम्बर
رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ईमामे अबू यूसुफ़ को नसीहतें	4	उ-लमा से गुफ़्त-गू के आदाब	12
भादशाहों से मेलजोल में अहतियातें	4	किसी के बड़ों को बुरा कहने से बचना	13
हुन्यवी गुफ़्त-गू से बचने की नसीहत	6	जाहिर व बातिन अेक रबना	14
अमरदों से बचने की नसीहत	6	ओहूअे कआ कबूल करने या न करने की नसीहत	14
बड़ों का अहब करने की नसीहत	6	मुनाजरे के मु-तअद्विक नसीहत	14
रास्तों और मसाजिद में पाने से परहेज	7	मुर्दा टिली के अस्बाब	14
अरूदवाज्ज जिन्दगी के आदाब	7	यलने और गुफ़्त-गू करने के आदाब	15
पडले ईल्मे दीन हासिल करना	9	जिहुल्लाह اَلْحَقُّ كِي कसरत	15
जवानी में हुसूले ईल्म की नसीहत	9	अवरादो वजाईफ़ की तल्कीन	15
हुस्ने मुआ-शरत की नसीहत	10	रोजे रबने की नसीहत	16
मस्अवा बयान करने में अहतियात करना	10	मुहा-स-बअे नफ़स	16
हुसूले ईल्म पर ईस्तिकामत की नसीहत	11	भरीदो इरोप्त की अहतियातें	16
त-लबा की भैर प्वाही की नसीहत	11	आजिजी की नसीहत	17
अगडालू से न उलजना	11	मुअर्रज लोणों की ईस्वाह का तरीका	18
बचाने हक में निडर होने की नसीहत	12	भादशाह की ईस्वाह का तरीका	18
अहले ईल्म का अहब करना	12	मौत को ब कसरत याद करने की नसीहत	19

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 أَتَابَعُدُّ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

(1)... ઈમામે અબૂ યુસુફ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કો ગસીહતે બાદશાહોં સે મેલજોલ મેં એહતિયાતે :

«1»..... એ યા'કૂબ⁽¹⁾ ! બાદશાહ કી ઈઝ્જત વ તૌકીર કરના. ઉસ કે મન્સબ કી અ-ઝમત કા લિહાઝ રખના ઓર ઉસ કે સામને ઝૂટ બોલને સે ઈજિતનાબ કરના.

«2»..... જબ તક બાદશાહ સે તુઝે કોઈ ઈલ્મી હાજત દરપેશ ન હો બિલા ઝરૂરત ઉસ કે દરબાર મેં ન જાના ક્યૂંકે અગર તૂ ઉસ કે સાથ ઝિયાદા મેલજોલ રખેગા તો વોહ તુઝે હલકા ઓર હકીર જાનને લગેગા ઓર તેરી કદ્રો મન્જિલત ઉસ કી નઝર મેં કમ હો જાએગી. ઈસ લિયે બાદશાહ સે આગ જૈસા બરતાવ કર કે દૂર રહ કર ઉસ સે નફ્અ હાસિલ કર ઓર જિસ તરહ જલને ઓર તક્લીફ મેં મુબ્તલા હોને કે ડર સે આગ કે કરીબ કોઈ નહીં જાતા ઈસી તરહ બાદશાહ કે કરીબ જાને સે ભી કતરાતે રહના ઓર ઉસ કી ઈઝા સે ખુદ કો બચાતે રહના ક્યૂંકે વોહ અપને ઈલાવા કિસી કો કુછ નહીં સમઝતા.

«3»..... બાદશાહ કે સામને કસરતે કલામ સે ગુરેઝ કરના ક્યૂંકે વોહ અપને મુસાહિબોં ઓર દરબારિયોં કે સામને તુઝ પર અપને ઈલ્મ કી

1..... ઈમામ અબૂ યુસુફ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ કા નામ યા'કૂબ હૈ મગર અપની કુન્યત અબૂ યુસુફ સે મશહૂર હૈ. ઈલ્મિયા

بدرتरी जताने के लिये तुम्हारी बातों पर पकड करेगा और तुम्हारी ग-लतियां निकालेगा जिस की वजह से तुम लोगों में जलील हो जाओगे.

«4»..... इस बात का ખયાલ रખना के जब तुम बादशाह के दरबार में जाओ तो वोह तुम्हारे और आम लोगों के मकाम व मर्तबा में झूँक पडयानता और उस का लिहाज करता हो.

«5»..... बादशाह के पास जाते हुअे इस बात का लिहाज रખना के उस के दरबार में अैसे अहले इल्म हजरत मौजूद न हों जिन के इल्मी मकाम की तुम्हें ખबर न हो क्यूंके अैसी सूरते हाल में ખदशा है के तुम्हें उन से जियादा इज्जत व मकाम बप्शा जाअे हालांके वोह तुम से जियादा इल्म वाले हों तो येह बात तुम्हें नुकसान देगी या हो सकता है तुम्हारा मकाम व मर्तबा कम कर दिया जाअे हालांके तुम इल्म में उन से बढ कर हो. तो इस वजह से तुम बादशाह की नजर से गिर जाओगे.

«6»..... जब तुम्हें कोई शाही ओहदा पेश किया जाअे तो उस वक्त तक कबूल न करना जब तक तुम येह न जान लो के बादशाह इल्म और झैसलों में तुम्हारे मस्लक व मजहब से राजी है ताके हुकूमती मुआ-मलात में किसी दूसरे के मस्लक की तरफ रुजूअ न करना पडे.

«7»..... बादशाह के मुसाहिबीन व मुहाइजीन से हरगिज तअद्लुकात काईम न करना बल्के सिई बादशाह से तअद्लुक रખना.

«8»..... उस के मुसाहिबीन से दूर रहना ताके तुम्हारा जाहो जलाल बाकी रहे.

«9»..... अवाम के सामने इतनी ही बात करना जितनी तुम से पूछी जाअे.

दुन्यवी गुफ्त-गू से बयने की नसीहत :

«10»..... हमेशा ँल्मी बात करना, दुन्यवी मुआ-मलात व तिज्जरत के बारे में गुफ्त-गू से ँजितनाब करना क्यूंके ँस से नुकसान येह ढोगा के लोग माल की तरफ़ तुम्हारी रग्गत देष कर तुम पर रिश्वत के लैन दैन की बढ गुमानी में मुब्तला ढो ज़ांगे.

«11»..... आम लोगों के दरमियान बैढो तो हंसी मजाक से अेहतिराज करना.

«12»..... बिला ज़रत बाजार में जियादा आने जाने से बयना.

अम्रदों से बयने की नसीहत :

«13»..... अम्रदों (या'नी जिन लडकों को देष कर शहवत आअे उन) से गुफ्त-गू न करना क्यूंके वोह झितने का बाँस हैं. ढोटे बच्चों के साथ गुफ्त-गू करने और उन के सरों पर हाथ झैरने में हरज नहीं.

बडों का अदब करने की नसीहत :

«14»..... गैरे आलिम बूढों के साथ रास्तों के दरमियान न यलना क्यूंके अगर तूने उन को मुकदम किया तो तेरे ँल्मी मकाम को अैब लगेगा और अगर उन से आगे यला तो तुज पर अैब लगेगा के तूने उन का अेहतिराम नहीं किया ढालांके हुज़ूरे पुरनूर, शाइंअे यौमुन्नशूर

كَأَنَّكَ إِذَا دَخَلْتَ عَلَيْهِمْ مِنْ بَابٍ أَلَيْسَ مِنْ بَابِهِمْ خَرَجْتَ مِنْهُمْ بِبَابٍ آخَرَ وَتِلْكَ آيَاتُ الَّذِينَ كَذَبُوا كَذِبًا كَرِيمًا

«जो हमारे बडों की

‘ঈজ্জত ওর ছোটোঁ পর শফ্কত নহীঁ করতা বোহ হম মেঁ সে নহীঁ .’

(جامع الترمذی، ابواب البر والصلة، ماجاء فی رحمة الصبیان،
 الحدیث: ۱۹۱۹، ص ۱۸۴۵، دار السلام للنشر والتوزیع الرياض)

রাস্তোঁ ওর মসজিদ মেঁ খানে সে পরহেজ :

﴿15﴾..... রাস্তোঁ মেঁ মত বৈঠনা, জরুরত ছো তো মসজিদ মেঁ বৈঠ জানা.

﴿16﴾..... বাজারোঁ ওর মসজিদোঁ মেঁ ন খানা পীনা, ন ছী দুকানোঁ পর বৈঠনা.

﴿17﴾..... সখীলোঁ ওর উন পর পানী পিলানে বালোঁ সে পানী ন পীনা (কে বোহ আলিম ওর জাছিল মেঁ ফর্ক নহীঁ করতে).

﴿18﴾..... রেশম ওর জেবর (সোনে কী অংগুঠী, লোকিট বগৈরা) ওর কিসী কিসম কা সিল্ক (যা'নী রেশম) ন পছননা কয়ুঁকে ঈস কা ঈস্তি'মাল তুজে তকব্বুর মেঁ মুত্তলা কর দেগা.

অজ্জবাহ জিন্দগী কে আদাব :

﴿19﴾..... অপনী শরীকে ছয়াত সে বিস্তর মেঁ জিয়াছা গুফ্ত-গুন করনা, ব বকতে জরুরত ওর ব কদরে জরুরত বাত পর ছী ঈক্তিফা করনা. (1)

﴿20﴾..... ওরত সে জিয়াছা জিমাঅ করনে ওর উস কো জিয়াছা ছুনে সে ঈজিতনাব করনা.

﴿21﴾..... জিমাঅ সে কবল অল্লাহ عَزَّوَجَلَّ কা জিক করনা ফির

1 : আ'লা হজরত, ঈমামে অহলে সুন্নত ঈমাম অহমদ রজা খান عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن عَلَيْهِ
 “মশ-অ-লতুল ঈশাফ ফী হুকুকিল আওয়াদ” মেঁ ফরমাতোঁ হেঁ: “(দীরানে জিমাঅ) জিয়াছা
 বাতে ন করে কে (আওয়াদ কে) গুঁগে যা তোতলে ছোনে কা খতরা হেঁ.”

(ইতাবা ২-জবিয্যা, জি. 24, স. 452, রজা ফাউন্ডেশন বাছরে)

उस से हम बिस्तरी करना.

«22»..... अपनी बीवी के सामने दूसरों की औरतों और नोकरानियों का जिक्र न करना क्यूंके इस तरह वोह तुज से बे परवाह हो जायेगी. और हो सकता है के जब तू उस के सामने दूसरी औरतों का तजकिरा करे तो वोह भी तुज से दूसरे मर्दों का जिक्र करने लगे.

«23»..... अगर हो सके तो ऐसी औरत से शादी न करना जो बेवा हो या जिस के मां बाप हों या जिस की पहले से औलाद हो और अगर ऐसी औरत से निकाह करना पडे तो येह शर्त रख लेना के उस के करीबी रिश्तेदार उस से (ब कसरत) नहीं मिलेंगे.

«24»..... अगर औरत मालदार हुई तो उस का बाप दा'वा करेगा के तेरी बीवी के पास मौजूद माल मेरा है मैं ने उसे आरिख्यतन दिया था (इस का मतलब येह होगा के तुम हमारे टुकड़ों पर चल रहे हो और येह बात तुम्हें ना गवार गुजरैगी).

«25»..... जिस कदर मुम्किन हो अपने सुसराल जाने से अहत्तराज करना.

«26»..... दरगिज घर दामाद बनने (या'नी सुसराल के हां रहने) पर राजी न होना इस लिये के अगर तू उन के पास रहने लगा तो वोह माल की दालय में तुज से तेरा माल ले लेंगे और इस का दूसरा नुकसान येह होगा के तेरी बीवी तेरे अण्वाक व आदात में न ढल सकेगी.

«27»..... औलाद वाली औरत से निकाह न करना क्यूंके वोह अपना सारा माल उन के लिये जम्अ कर रखेगी और यूंके उस को

अपनी औलाद तुज से जियादा अजीज होगी जिस की वजह से वोह

तेरा माल युरा युरा कर उन पर ખર્च करेगी.

﴿28﴾..... अक घर में दो बीवियों को जम्भ करने से गुरेज करना.

﴿29﴾..... निकाह से पहले इस बात की मुकम्मल तौर पर तसल्ली कर लेना के तुम अपनी बीवी की तमाम हाजत व जरूरियात पूरी कर सकते हो.

पहले एल्मे दीन हासिल करना :

﴿30﴾..... इस बात का ખयाल रખना के पहले एल्मे दीन हासिल करना फिर कस्बे हलाल से माल जम्भ करना इस के बा'द निकाह करना और अगर तू दौराने तालिबे एल्मी माल की तलब में मशगूल हो गया तो एल्मे दीन हासिल न कर सकेगा और माल तुझे लौंडियां और ખुद्दाम ખरीदने पर आमादा करेगा और यूं तू दुन्या में मशगूल हो जायेगा. जमाने तालिबे एल्मी में इस बात का ल्मी लिहाज रખना के दिल में हरगिज औरतों की रब्बत पैदा न हो के यूं तेरा वक्त जायेज होगा और तेरे अहलो एयाल कसीर हो जायेंगे और तू उन की जरूरियात पूरी करने में मशगूल हो कर एल्मे दीन और माल दोनों से रह जायेगा.

जवानी में हुसूले एल्म की नसीहत :

﴿31﴾..... जैसे वक्त में त-लबे एल्म में मशगूल हो जबके तेरे जवानी के एब्तिदाए अय्याम हों और तेरा दिल दुन्यवी मुआ-मलात से झरिग हो. इस के बा'द कस्बे हलाल करना ताके तेरे पास कुछ

માલ જમ્મ હો જાએ (ઔર નિકાહ સે પહલે ત-લબે ઈલ્મ કી ઝરૂરત ઈસ લિયે હૈ) ક્યૂંકે અહલો ઈયાલ કી કસરત દિલ કી તશવીશ કા બાઈસ બનતી હૈ ઔર જબ તેરે પાસ બ કદરે ઝરૂરત માલ જમ્મ હો જાએ તો નિકાહ કર લેના ઔર અપની બીવી કે સાથ ઉસી તરહ ઝિન્દગી બસર કરના જિસ તરહ મૈં ને તુઝે બતાયા હૈ.

﴿32﴾..... ખૌફે ઈલાહી **عَزَّوَجَلَّ** ઔર તકવા, અમાનતોં કી અદાએગી ઔર અવામ વ ખવાસ કી ખૈર ખવાહી કો અપને ઊપર લાઝિમ કર લેના.

હુસ્ને મુઆ-શરત કી નસીહત :

﴿33﴾..... લોગોં કો અપને સે કમતર ઔર હકીર ન જાનના બલ્કે ઉન કી ઈઝતે નફ્સ કા લિહાઝ રખના ઔર ઉન સે ઝિયાદા મેલજોલ ભી ન રખના ઔર જો લોગ ખુદ તુઝ સે મેલજોલ રખના ચાહેં ઉન કો દીની મસાઈલ સે આગાહ કરના તાકે ઉન મેં સે ઈલ્મ કા ઝૈક રખને વાલા ત-લબે ઈલ્મ મેં મશ્ગૂલ હો જાએ ઔર જો ઈલ્મ સે દિલ યસ્પી નહીં રખતા વોહ નારાઝ હુએ બિગૈર તુઝ સે દૂર હો જાએ.

મસ્અલા બયાન કરને મેં એહતિયાત કરના :

﴿34﴾..... અવામુન્નાસ કો દીની બાતેં ઈલ્મે કલામ કે અન્દાઝ મેં ન બયાન કરના ક્યૂંકે લોગ તુમ્હારી તકલીદ કરેંગે ઔર ઈલ્મે કલામ મેં મશ્ગૂલ હો જાએંગે.

﴿35﴾..... જબ કોઈ તુઝ સે મસ્અલા દરયાફત કરને આએ તો ઉસે

सिर्फ उस के सुवाल का जवाब देना और उस में ऐसी जियादती न करना जो उसे असल जवाब समझने में दृश्वारी पैदा करे.

हुसूले ँल्म पर ँस्तिकामत की नसीहत :

﴿36﴾..... अगर तुम पूराक और करबे मआश के बिगैर दस साल भी जिन्दा रह सको तब भी ँल्मे दीन से दूरी ँप्तियार न करना क्यूंके अगर तुम ने ँल्मे दीन से मुंड मोडा तो तुम्हारी मँशत तंग हो जायेगी. जैसाके अद्लाह عَزَّوَجَلَّ का इरमाने ँभ्रत निशान है :

(ب ۱۶، ط ۱۲۴) وَمَنْ أَعْرَضَ عَنِ ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنْكًا त तर-ज-मओ कन्जुल ँमान : और जिस ने मेरी याद से मुंड फ़ैरा तो बेशक उस के लिये तंग जिन्दगानी है.

त-लभा की ખैर ખ्वाही की नसीहत :

﴿37﴾..... जो लोग तुज से ँल्मे फ़िकल हासिल करें उन पर पूरी तवज्जोह देना और उन सब के साथ बेटों जैसा सुलूक करना ताके उन की ँल्म में रगबत मज़ीद बढे.

जगडावू से न उलजना :

﴿38﴾..... अगर कोई बाजारी या आम शप्स तुज से जगडा करे तो उन से न जगडना बढके अइवो दर गुजर से काम लेना क्यूंके अगर तू उन से जगडा करेगा तो लोगों की नजरों में तेरी ँज्जत कम हो जायेगी.

बयाने उक में निउर होने की नसीहत :

﴿39﴾..... उक बयान करने में किसी के रो'ब में न आना अगर्चे बादशाह ही क्यूं न हो.

﴿40﴾..... अपने आप को दीगर लोगों से जियादा ईबादत में मशगूल रखना क्यूंके जब आम लोग तुजे अपनी ईबादत से जियादा नेकियों पर मु-तवज्जेह होता न पाअेंगे तो वोह तेरे बारे में बुरा गुमान करेंगे और समजेंगे के ईबादत में तेरी हिल यस्पी कम है. नीऊ वोह येह गुमान करेंगे के तेरे ईल्म ने तुजे ईतना ही नईअ दिया जितना नईअ उन्हें उन की जहालत ने दिया.

अहले ईल्म का अदब करना :

﴿41﴾..... जब तू अहले ईल्म के शहर में दाखिल हो तो अपने ईल्म को (जाह व मन्सब, क लिये) मत ईप्तिचार करना बल्के वहां अेक आम शहरी की तरह रहना ताके वोह जान लें के तेरा मकसद उन की अ-उमत व बुजुर्गी को लोगों की नजर में कम करना नहीं वरना वोह सब के सब तेरे मुकाबले में आ जाअेंगे और तेरे मजहब पर ता'न करेंगे और आम लोग भी तेरे खिलाफ उठ जडे होंगे और तुजे (तेज) नजरों से देखेंगे और तू उन के नजदीक प्वाह म प्वाह जलील हो जाअेगा.

उ-लमा से गुफ्त-गू के आदाब :

﴿42﴾..... (अहले ईल्म की मौजूदगी में) इतवा न देना अगर्चे

વોહ તુઝ સે મસાઈલ મેં ફતવા તલબ કરેં ઓર ન હી ઉન સે બહસ વ મુબા-હસા કરના.

﴿43﴾..... ઉન અહલે ઈલ્મ કે સામને બિગૈર કિસી વાઝેહ દલીલ કે કોઈ બાત બયાન ન કરના.

કિસી કે બડોં કો બુરા કહને સે બયના :

﴿44﴾..... અહલે ઈલ્મ કે અસાતિજા કો બુરા ભલા ન કહના વરના વોહ તુઝે લા'ન તા'ન કરેંગે. જૈસાકે અલ્લાહ ﷻ કુરઆને પાક મેં ઈશાદિ ફરમાતા હૈ : “ (۱۰۸: الانعام: ۱۷۶) ” وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ

તર-જ-મએ કન્ઝુલ ઈમાન : ઓર ઉન્હેં ગાલી ન દો જિન કો વોહ અલ્લાહ કે સિવા પૂજતે હેં કે વોહ અલ્લાહ કી શાન મેં બે અ-દબી કરેંગે ઝિયાદતી ઓર જહાલત સે.”⁽¹⁾

﴿45﴾..... લોગોં સે મોહતાત રહના (યા'ની કિસી સે ધોકા ન ખાના).

1 : ખલીફએ આ'લા હઝરત, સદરુલ અફાઝિલ, સચ્ચિદ મુહમ્મદ નઈમુદીન મુરાદઆબાદી رحمه الله الهادي તફસીરે ખઝાઈનુલ ઈરફાન મેં ઈસ આયતે મુબા-રકા કી તફસીર મેં ફરમાતે હેં : “કતાદા કા કૌલ હૈ કે મુસલ્માન કુફરાર કે બુતોં કી બુરાઈ ક્રિયા કરતે થે તાકે કુફરાર કો નસીહત હો ઓર વોહ બુત પરસ્તી કે ઐબ સે બા ખબર હોં મગર ઉન ના ખુદા શનાસ જાહિલોં ને બજાએ પન્દ પઝીર હોને કે શાને ઈલાહી (ﷻ) મેં બે અ-દબી કે સાથ ઝબાન ખોલની શુરૂઅ કી ઈસ પર યેહ આયત નાઝિલ હુઈ. અગર્યે બુતોં કો બુરા કહના ઓર ઉન કી હકીકત કા ઈઝહાર તાઅત વ સવાબ હૈ લેકિન અલ્લાહ (ﷻ) ઓર ઉસ કે રસૂલ (ﷺ) કી શાન મેં કુફરાર કી બદ ગોઈયોં કો રોકને કે લિયે ઈસ કો મન્અ ફરમાયા. ઈબને અમ્બારી કા કૌલ હૈ યેહ હુકમ અવ્વલ ઝમાને મેં થા જબ અલ્લાહ તઆલા ને ઈસ્લામ કો કુવ્વત અતા ફરમાઈ મન્સૂખ હો ગયા.”

जाहिर व बातिन अेक रभना :

«46»..... तू जिस तरल लोगों के सामने रहे उन की गैर मौजूदगी में भी ईसी तरल रला करना क्यूंके तेरा ईल्मी मुआ-मला उस वक्त तक सहील नहीं हो सकता जब तक तू अपने जाहिर व बातिन को अेक न कर ले.

ओह्दअे कआ कबूल करने या न करने की नसीहत :

«47»..... जब बादशाह तुम्हें किसी अैसे काम की जिम्मादारी सोंपे जे तुम कर सकते हो तो उसे उस वक्त तक कबूल न करना जब तक ईस बात का यकीन न हो जाअे के अगर तुम उस काम की जिम्मादारी कबूल नहीं करोगे तो कोई ना अहल कबूल कर लेगा जिस से लोगों को नुकसान पड़ोयेगा और ईस के साथ साथ ईस बात का भी यकीन हो के तुम्हें वोह ओहदा तुम्हारी ईल्मी काबिलियत की वजह से दिया जा रला है.

मुनाजरे के मु-तअद्लिक नसीहत :

«48»..... मजलिसे मुनाजरा में ખौફ और घबराहट के साथ गुफ्त-गू करने से बचना के येह हिल में ખलल पैदा करता है और जभान बोलने से रुक जाती है.

मुर्दा हिली के अरबाब :

«49»..... जियादा हंसने से बचना के ईस से हिल मुर्दा हो जाता है.

બિલ ખુસૂસ સબ્ર કી તૌફીક પર ઉસ કા શુક અદા કિયા કરો.

રોઝે રખને કી નસીહત :

﴿57﴾..... હર મહીને મેં ચન્દ દિન મખસૂસ કર કે ઉન મેં રોઝે રખા કરો તાકે દૂસરે લોગ ભી ઈસ મેં તુમ્હારી પૈરવી કરેં ઔર અપને લિયે ઈતની ઈબાદત પર રાઝી ન હોના જિતની પર આમ લોગ રાઝી હો જાતે હેં.

મુહા-સ-બએ નફસ :

﴿58﴾..... અપને નફસ કી નિગરાની કરો ઔર દૂસરોં કી ભી નિગરાની કરો તાકે વોહ તુમ્હારી દુન્યા વ આખિરત ઔર તુમ્હારે ઈલ્મ સે નફ્અ હાસિલ કરેં.

ખરીદો ફરોખ્ત કી એહતિયાતેં :

﴿59﴾..... બઝાતે ખુદ ખરીદો ફરોખ્ત ન કરો બલ્કે કિસી ખૈર ખ્વાહ કો મુકરર કર લો જો તુમ્હારે સારે કામ અન્જામ દે ઔર તુમ અપને મુઆ-મલાત મેં ઉસ પર એ'તિમાદ કરો.

﴿60﴾..... અપની દુન્યવી ઝિન્દગી ઔર મૌજૂદા આ'માલ સે મુત્મઈન ન હોના ક્યૂંકે અલ્લાહ તઆલા તુમ સે ઈન તમામ આ'માલ કે મુ-તઅલ્લિક પૂછગઇ ફરમાએગા.

﴿61﴾..... અમરદ ખુદામ (જિન્હેં દેખ કર શહવત આએ) મત ખરીદના.

﴿62﴾..... લોગોં પર ઝાહિર ન કરો કે મેં બાદશાહ કા કરીબી હું.

અગર્યે તુમહેં ઉસ કા કુર્બ હાસિલ હો ક્યૂંકે ઐસા કરને સે વોહ તુમહારે પાસ અપની હાજત લાઁંગે તાકે તુમ બાદશાહ કે દરબાર મેં ઉન કી સિફારિશ કરો ફિર અગર તુમ ઉન કી હાજત બાદશાહ કે પાસ લે ગએ તો બાદશાહ તુમહારી બે ઈઝ્ઝતી કરેગા ઓર અગર ન લે ગએ તો તુમહારા દા'વએ કુર્બ તુમહેં લોગોં કી નિગાહ મેં ઐબદાર બના દેગા.

આજિઝી કી નસીહત :

﴿63﴾..... અપના શુમાર આમ લોગોં મેં કરના લેકિન અપને ઈલ્મી મકામ વ મર્તબા કા લિહાઝ રખના.

﴿64﴾..... બુરે કામોં મેં હરગિઝ લોગોં કે પીછે ન ચલના બલ્કે અચ્છે કામોં મેં ઉન કી પૈરવી કરના.

﴿65﴾..... જબ તૂ કિસી કી બુરાઈ પર આગાહ હો તો ઉસ કી બુરાઈ કા ઝિક દૂસરોં કે સામને ન કરના બલ્કે ઉસ કે અન્દર ખૈર કા પહલૂ તલાશ કરના ઓર ઉસ કા ઝિક ઉસી ખૈર કે સાથ કરના. મગર દીની મુઆ-મલાત મેં લોગોં કે સામને ઉસ કી બુરાઈ બયાન કરના તાકે લોગ ઉસ કી પૈરવી ન કરેં ઓર ઉસ સે બચેં ક્યૂંકે સરકારે વાલા તબાર, હમ બે કસોં કે મદદગાર, શફીએ રોઝે શુમાર, બિ ઈઝને પરવદ્ ગાર દો આલમ કે માલિકો મુખ્તાર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ઈશાદિ ફરમાયા :

“ફાજિર કી બુરાઈયોં કા ઝિક કરો તાકે લોગ ઉસ સે બચેં.”

(المعجم الكبير، الحديث ١٠١٠، ج ١٩، ص ٤١٨، دار احياء التراث العربي بيروت)

મુઅઝ્ઝલ લોગોં કી ઈસ્લાહ કા તરીકા :

﴿66﴾..... જબ તુમ કિસી ઈઝ્ઝત વ વજાહત વાલે શખ્સ મેં દીની ખરાબી દેખો તો ઉસ કે જાહ વ મર્તબે કા લિહાઝ કિયે બિગૈર ઉસ કી ઈસ્લાહ કરો, અલ્લાહ ﷻ ઝરૂર તુમ્હારા ઓર અપને દીન કા મદદગાર હોગા ઓર જબ તુમ ને એક બાર ભી એસા કર દિયા તો લોગ તુઝ સે ડરેંગે ઓર ફિર કોઈ ભી તુમ્હારે સામને ઓર તુમ્હારે શહર મેં બિદઅત ઝાહિર કરને કી જુરઅત ન કરેગા ઓર એસે શખ્સ પર અવામ કો મુસલ્લત કર દો તાકે લોગ દીની જિદ્દો જહદ મેં તુમ્હારી ઈત્તિબાઅ કરેં.

બાદશાહ કી ઈસ્લાહ કા તરીકા :

﴿67﴾..... જબ તુમ બાદશાહ કે અન્દર કોઈ ખિલાફે શર-અ બાત દેખો તો ઉસ કી ઈતાઅત કરતે હુએ ઉસ કે સામને ઉસ બુરાઈ કા ઝિક્ક કર દો ક્યૂંકે ઉસ કી તાકત વ કુવ્વત તુમ સે ઝિયાદા હૈ, ઉસ સે યૂં કહો કે જિન બાતોં મેં આપ કો મુઝ પર ઈક્તિદાર વ ઈખ્તિયાર હાસિલ હૈ મેં ઉન મેં આપ કા ફરમાં બરદાર હૂં લેકિન આપ કે કિરદાર મેં કુછ એસી ચીઝેં દેખ રહા હૂં જો શરીઅત કે મુવાફિક નહીં. ઓર યેહ યાદ રહે કે એક મર્તબા નસીહત કર દેના હી કાફી હૈ, બાર બાર બાદશાહ કો નસીહત કરોગે તો ઉસ કે દરબારી તુમ્હારા અસર વ રુસૂખ ખત્મ કર દેંગે જિસ કી વજહ સે દીન કો ભી નુકસાન પહોંચેગા. એક યા દો મર્તબા નસીહત કર દો તાકે લોગ તુમ્હારી દીની જિદ્દો જહદ ઓર નેકી કી દા'વત કે

જઝબે કો જાન લેં. ઈસ કે બા'દ અગર બાદશાહ દોબારા કિસી બુરાઈ

का धरतिकाब करे तो उस के घर में तन्हाई में उसे ईस्लामी अडकाम पर अमल करने की तरगीब दो और अगर वोह बिदअती हो तो उस से मुनाजरा करो और कुरआने हकीम की आयाते बय्यिनात, इरामीने रसूले अकरम صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ में से जिस कदर तुम्हें याद हो उसे बयान कर के उस की ईस्लाह करने की कोशिश करो, अगर वोह हक बात कबूल कर ले तो ठीक है वरना बारगाहे जुदा वन्दी عَزَّوَجَلَّ में अर्ज करो के वोह तुम्हें जालिमों के जुल्म से मड़कू रभे.

मौत को ब कसरत याद करने की नसीहत :

《68》..... मौत को कसरत से याद करना, अपने असातिजा और उन तमाम जुजुर्गों के लिये दुआओ भगिरेत करना जिन से तुम ने ईल्मे दीन हासिल किया.

《69》..... और पाबन्दी से कुरआने पाक की तिलावत करते रहना.

《70》..... कब्रिस्तान, उ-लमा व मशाईष और मुकदस मकामात की जियारत कसरत से करना.

पवाबों की तस्दीक करने की नसीहत :

《71》..... आम लोग मसाजिद, मु-तबरक मकामात और कब्रिस्तान वगैरा में हुजूर नबिय्ये करीम صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ और सालिहीने उम्मत كَرَّمَ اللَّهُ تَعَالَى وَجْهَهُمْ की जियारत के मु-तअद्लिक जो प्वाब तुम से बयान करें उन्हें तस्वीम कर लेना.

बुरी सोडभत से बयना :

﴿72﴾..... ज्वाडिशते नफ़सानिया की पैरवी करने वालों के पास न बैठना, हां ! दीन और सिराते मुस्तकीम की दा'वत देने की खातिर उन के साथ बैठने में हरज नहीँ.

﴿73﴾..... गालम गलोज और किसी पर ला'नत भेजने से ँजितनाब करना.

मस्जिद जाने में जल्दी करना :

﴿74﴾..... जब मुअज्जिन अजान दे तो उस के बा'द जल्दी मस्जिद में हाजिरी की कोशिश करना, ताके आम लोग तुज पर सभ्कत न ले जाअें.

﴿75﴾..... बादशाह के पडोस में घर न बनाना.

﴿76﴾..... अगर तू अपने पडोसी में कोई अैब देभे तो उस की पर्दा पोशी कर के येह तेरे पास अमानत है और लोगों के राज आहिर करने से बय.

मश्वरा देने के आदाब :

﴿77﴾..... जब कोई शप्स तुम से मश्वरा तलब करे तो उसे उस बात का मश्वरा दो जिस के मु-तअद्लिक तुम्हें ँल्म हो के येह तुम्हें अद्लाह के करीब कर देगी. और मेरी ँस नसीहत को कबूल कर लो, **إِنَّ دُنْيَا وَآخِرَتَنَا لِلَّهِ عَزَّوَجَلَّ** व आभिरत में नफ़अ पाओगे.

﴿78﴾..... और बुज्बल से बय के ँस से ँन्सान ना पसन्दीदा व रुस्वा हो जाता है.

बा मुरुव्वत रहने की नसीहत :

﴿79﴾..... लालची, जूटा और मुआ-मलात को गुडमुड करने वाला न बनना बल्के तमाम उमूर में अपनी मुरुव्वत को मलफूज रखना.

﴿80﴾..... अपने तमाम अहवाल में सफ़ेद लिबास ही पहनना.

ईजहारें गिना व ईफ़ाअे इकर की तल्कीन :

﴿81﴾..... दिल् के गनी बन जाओ, अपने आप को दुन्या में कम रज्बत रखने वाला और मालो दौलत की लालच न करने वाला जाहिर करो और भुद को हमेशा गनी जाहिर करो और मोहताज व तंगदस्ती के बा वुजूद ईस का ईजहार न करो.

﴿82﴾..... बा हिम्मत व हौसला मन्द बन के रहना के पस्त हिम्मत की कद्रो मन्जिलत कम हो जाती है.

﴿83﴾..... रास्ते में यलते हुअे ईधर उधर देबने के बजाअे हमेशा निगाहें नीची रखना.

हम्माम में जाने की अेहतियातें :

﴿84﴾..... जब हम्माम में जाना हो तो वहां न आम लोगों के साथ बैठना और न ही हम्माम की उजरत में आम लोगों की बराबरी करना बल्के उन से बढ कर उजरत देना ताके लोगों में तुम्हारी मुरुव्वत जाहिर हो और वोह तुम्हारी ईज्जत करें.

कामकाज के लिये नोकर रखने की तरगीब :

﴿85﴾..... अपना माल जूलाहा (या'नी कपडा बुनने वाले) और मुफ्तलिफ़ काम करने वालों के हवाले भुद न करना बल्के इस काम के लिये कोई ऐसा बा अे'तिमाद शप्स रखना जो येह काम करे.

टेक्स न लेने की नसीहत :

﴿86﴾..... अनाज और दिरहमो दीनार पर लोगों से टेक्स न लेना.

﴿87﴾..... दरालिम का वज़्न भुद न करना बल्के इस के लिये किसी बा अे'तिमाद शप्स का ँन्तिभाब करना.

﴿88﴾..... अहले ँल्म के नज़दीक जलील व हकीर दुन्या को तुम ली हकीर जानना क्यूंके जो अद्लाह ٱٱٱ के पास है वोह इस से बहोत बेहतर है.

﴿89﴾..... तमाम मुआ-मलात किसी बा अे'तिमाद शप्स के सिपुर्द कर देना ताके तुम मुकम्मल तौर पर ँल्मे दीन की तरफ़ मु-तवज्जेह हो सको, इस से तुम्हारे ज़ाहो जलाल की डिफ़ाजत रहेगी.

ँल्मी गुफ़्त-गू करने के लिये अइराद का ँन्तिभाब :

﴿90﴾..... बे वुकूफ़ों से बात न करना, मुनाज़रे के तरीके और दलील के सलीके से ना वाकिफ़ अहले ँल्म से ली कलाम न करना और ँज़्ज़त व शोहरत के लिये मसाँले शर-ँय्या में बहस करने वालों से ली गुफ़्त-गू न करना क्यूंके उन का मकसद येह होग़ा के वोह तुम्हें ज़लीलो रुस्वा करें और वोह तुम्हारी कोई परवाह न करेंगे अगरेँ जानते हों के तुम हक पर हो.

बुजुर्गों की बारगाह के आदाब :

《91》..... बुजुर्गों के पास जाओ तो उस वक्त तक भरतरी न याहना जब तक के वोह भुद तुम्हें भरतरी न दें ताके तुम्हें उन से कोई परेशानी न पड़ोये.

《92》..... जब तुम कुछ लोगों के साथ हो तो जब तक वोह तुम्हें भतौरे ता'जीम आगे न करें उस वक्त तक उन की ईमामत न कराना.

《93》..... हम्माम जाना हो तो दो पहर या सुब्ह के वक्त में जाना और सैरो तफ़रीह के मकामात की तरफ़ न जाना.

《94》..... बादशाहों के जुल्म की जगहों पर उन के पास उस वक्त तक जाने से गुरेज करना जब तक तुम्हें यकीन न हो जाअे के तुम्हारी हक बात मान कर वोह लोगों पर जुल्मो सितम से बाज आ जाअेंगे इस लिये के अगर तुम्हारी मौजूदगी में बादशाहों ने किसी ना जाईज व हराम काम का ईरतिकाब किया और तुम ताकत न होने की वजह से उन्हें उस ना जाईज ई'ल से न रोक सके तो लोग तुम्हारी भामोशी की वजह से उस ई'ले नाहक को हक समज लेंगे.

《95》..... ईल्मी महफ़िल में गुस्सा करने से बचना.

《96》..... लोगों के सामने किस्से कलानियां बयान न करना क्यूंके

किस्सा गो ज़रूर जूट बोलता है.

ઈલ્મી મહફિલ કે આદાબ વ એહતિયાતે :

﴿97﴾..... જબ તુમ કિસી સાહિબે ઈલ્મ કી મહફિલ મેં શિર્કત કા ઈરાદા કરો તો દેખ લો અગર વોહ ફિક્હ કી મહફિલ હો તો ઉસ મેં શિર્કત કર લો ઓર જો ઈલ્મ હાસિલ કરો વોહ લોગોં કે સામને બયાન કર દો ઓર અગર વોહ આમ વાઈઝ હો તો ઉસ કી મહફિલ મેં શિર્કત ન કરો તાકે તુમ્હારી વજહ સે લોગ ધોકે મેં ન પડેં ઓર ઉસ શખ્સ કે મુ-તઅલ્લિક યેહ ન સમજેં કે યેહ ઈલ્મ કે આ'લા દ-રજે પર ફાઈઝ હૈ હાલાંકે હકીકત મેં એસા નહીં હોગા ઓર અગર વોહ ફતવા દેને કી સલાહિયત રખતા હો તો લોગોં કો ઉસ કે મુ-તઅલ્લિક બતાઓ ઓર અગર ઈસ કી સલાહિયત ન રખતા હો તો ઉસ કી મહફિલ મેં ન બૈઠના કે વોહ તુમ્હારે સામને દર્સ દે બલ્કે વહાં અપને કિસી કાબિલે એ'તિમાદ દોસ્ત કો ભેજ દેના જો ઉસ કે કલામ કી કૈફિયત ઓર ઈલ્મી મકામ કે મુ-તઅલ્લિક તુમ્હેં ખબર દે સકે.

﴿98﴾..... એસોં કી મહફિલે વા'ઝ વ ઝિક મેં ન જાના જો તુમ્હારે જાહ વ મર્તબા ઓર તઝકિયા કે ઝરીએ અપની શોહરત ચાહતે હોં બલ્કે અપને મહલ્લે કે કિસી બા એ'તિમાદ આમ આદમી કો અપને કિસી શાગિર્દ કે સાથ ભેજ દેના.

﴿99﴾..... ખુબએ નિકાહ, નમાઝે જનાઝા વ ઈદેન પઢાને કી ઝિમ્માદારી અપને અલાકે કે કિસી ખતીબ કે સિપુર્દ કર દેના, મુઝે અપની નેક દુઆઓ મેં યાદ રખના ઓર મેરી યેહ નસીહતેં કબૂલ કર લેના, બિલા શુબા યેહ

الأشباه والنظائر، الأشباه والنظائر، التمشاری اور تمام مسلمانوں کی اہلسلاط کے لیے ہے۔

وصیة الامام اعظم لأبی یوسف رحمہما اللہ تعالیٰ، ص ۳۶۷ تا ۳۷۲، دار الکتب العلمیة بیروت۔ مناقب الامام الاعظم للموفق، الجزء الثانی، وصیة الامام اعظم لأبی یوسف رحمہما اللہ تعالیٰ، ص ۱۱۳ تا ۱۱۹، مکتبہ اسلامیہ کوئٹہ

(2).... **حزرتے یوسف بن یمینہ کی رحمة اللہ علیہ کی بستیہوں**

حزرتے سخیہنا یوسف بن یمینہ سماتی ہسری
رحمة اللہ علیہ نے تکمیلے اہلم کے با'د جب حزرتے سخیہنا
امامہ آ'ام سے اپنے شہر ہسرا جانے کی اہلالت
تلاب کی تو آپ رحمة اللہ علیہ نے فرمایا : “کوفہ دین اہرو تاکہ
میں تمہیں اون اہری اہم کے متاقلک وصیہت کڑے کے لوگوں کے
ساہ متا-ملاات کرنے، اہلے اہلم کے مراتب پلہاننے، نرس
کی اہلسلاط اور لوگوں کی نلگاہانی کرنے، اوام و ہواس کو
اوست رپنے اور آم لوگوں کے االاات سے آااا ااسل کرنے کے
لیے جن کی اہرت پاتلی ہے یہاں تک کے جب تم اہلم ااسل کرنے
کے آاو تو وول وصیہت تمہارے ساہ اےسے آالے کی ترل اے جس
کی اہلم کو اہرت اوتلی ہے اور وول اہلم کو متاھن کرے اور
اسے اہلدار اےسے ہیاہے۔”

(1)..... یاہ رپو ! ااار تم لوگوں کے ساہ اہسے سلوک سے پش ن آاے
تو وول تمہارے اہمن بن آاے ااے تمہارے ماں باپ اے کھن اے۔

(2)..... જબ તુમ લોગોં કે સાથ અચ્છા બરતાવ કરોગે તો વોહ તુમ્હારે માં બાપ કી તરહ હો જાએંગે અગર્યે તુમ્હારે ઓર ઉન કે દરમિયાન કોઈ રિશ્તા નાતા ન હો.

(હઝરતે સચ્ચિદુના યૂસુફ બિન ખાલિદ બસરી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْعَظِيمِ ફરમાતે હેં :) “ફિર હઝરતે સચ્ચિદુના ઈમામે આ'ઝમ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને મુઝ સે ફરમાયા : “કુછ દિન સબ્ર કરો યહાં તક કે મેં તુમ્હારે લિયે અપની મસરૂફિયાત સે વક્ત નિકાલૂં ઓર અપની તવજ્જોહ કો તુમ્હારી તરફ મબ્જૂલ કર લૂં ઓર તુમ્હેં એસે ઉમ્દા કામોં કી પહચાન કરા દૂં જિસ કી વજહ સે તુમ દિલી તૌર પર મેરે શુક ગુઝાર રહો ઓર નેકી કરને કી તૌફીક અલ્લાહ وَجَّوْهِي કી તરફ સે હૈ.” જબ વા'દે કી મુદત પૂરી હો ગઈ તો હઝરતે સચ્ચિદુના ઈમામે આ'ઝમ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને અપની મસરૂફિયાત સે વક્ત નિકાલા ઓર ઈશાદ ફરમાયા :

(3)..... આજ મેં તુમ્હારે સામને ઉન હકાઈક સે પદા ઉઠાઉંગા જિન્હેં બયાન કરને કા મેં ને કસ્દ કિયા થા ગોયા મેં દેખ રહા હૂં જબ તુમ બસરા મેં દાખિલ હો કર હમારે મુખાલિફીન કા રુખ કરોગે, ઉન પર અપની બરતરી જતાઓગે, અપને ઈલ્મ કે સબબ ઉન કે સામને ગુરૂર વ તકબ્બુર કરોગે, ઉન સે મિલના જુલના, ઉઠના બૈઠના તર્ક કર દોગે. તુમ ઉન કી મુખા-લફ્ત કરોગે ઓર વોહ તુમ્હારી મુખા-લફ્ત કરેંગે, તુમ ઉન્હેં છોડ દોગે ઓર વોહ તુમ્હેં છોડ દેંગે, તુમ ઉન્હેં બુરા ભલા કહોગે ઓર વોહ તુમ્હેં કહેંગે, તુમ ઉન્હેં ગુમરાહ કહોગે ઓર વોહ તુમ્હેં કહેંગે ઓર ઈસ સે મેરી ઓર તુમ્હારી રુસ્વાઈ હોગી. પસ

تुम उन से दूरी ँप्तियार करने और भागने पर मजबूर हो जाओगे। मगर येह दुरुस्त राय नहीं क्यूंके वोह अकल मन्द नहीं जो उन लोगों से तअल्लुकात काँम न कर सके जिन् के साथ अख्छे तअल्लुकात रभना जरूरी हो यहां तक के अल्लाह ُكَوَّكُّ उस के लिये कोई राह निकाल दे.

﴿4﴾..... जब तुम बसरा में दाखिल होगे तो लोग तुम्हारे ँस्तिकबाव और तुम्हारी जियारत को आअेंगे, तुम्हारा हक पडयानेंगे तो तुम हर शप्स को उस के मर्तबे के लिहाज से ँज्जत देना, शु-रफ़ा की ँज्जत और अहले ँल्म की ता'जीमो तौकीर करना, बडों का अदब व अेहतिराम और छोटों से प्यार व महब्बत करना, आम लोगों से तअल्लुक काँम करना, फ़ासिक व फ़ाजिर को जलीलो रुस्वा न करना, अख्छे लोगों की सोहबत ँप्तियार करना, सुल्तान की ँछानत करने से बचना, किसी को ली हकीर न समजना, अपने अप्लाक व आदात में कोताही न करना, किसी पर अपना राज ज़ाहिर न करना, बिगैर आजमाअे किसी की सोहबत पर लरोसा न करना, किसी जलील व घटिया शप्स की ता'रीफ़ न करना और किसी अैसी चीज से महब्बत न करना जो तुम्हारे ज़ाहिरि हाल के बिलाफ़ हो.

ज़ाहिलों से अे'राज की नसीहत :

﴿5﴾..... बे वुकूफ़ और ज़ाहिल लोगों से बे तकल्लुफ़ी से मत पेश आना, उन की कोई दा'वत या हदिय्या कबूल न करना और हर काम ँस्तिकामत व हमेशगी से करना.

ॲ6)..... गम प्वारी, सभ्र, बुर्दुबारी, हुस्ने अण्वलाक और वुस्अते कल्बी को अपने लिये लाजिम कर लेना, नमाज में उम्हा लिबास जैबे तन करना, सुवारी के लिये अख्ण ज़ानवर रपना और पुशबू ब कसरत ईस्ति'माल करना, अपनी जल्वत के लिये कुछ वक्त निकालना जिस में अपनी ज़ाती ज़रूरिय्यात पूरी कर सकी.

ॲ7)..... अपने पुदाम की जबर गीरी करते रहना, उन की तादीब व तरबिय्यत का पुसूसी अेडतिमाम करना, ईस मुआ-मले में उन से नरमी बरतना और बे ज़ सप्ती न करना के वोड ढीट डो ज़अें, उन्हें पुद सज़ा न देना ताके तुम्हारा वकार बर करार रहे, नमाज की पाबन्दी करना और गरीबों इकीरों पर स-दका व ज़ैरात करते रहना क्यूंके बज्बील शप्स कबी सरदार नहीं बन सकता.

ॲ8)..... तुम्हारे पास अेक काबिले अे'तिमाद शप्स डोना याहिये ज़े तुम्हें लोगों के अडवाल से आगाड करता रहे, जब तुम किसी की बुराई पर मुतलअ डो ज़ओ तो उस की ईस्लाड की जल्ल कोई तदबीर करना और जब किसी की पूबी से आगाडी डो तो उस की तरइ ज़ियादा तवज्जोड और रगत करना, उस से भी मिलते रडो ज़े तुम से मिले और ज़े न मिले उस से भी मिलते रडो. ज़े तुम्हारे साथ बलाई करे उस के साथ भी बलाई करो और ज़े बुराई से पेश आअे उस के साथ भी अख्णई से पेश आओ, अइवो दर गुजर की आदत अपनाओ और नेकी का हुकुम देते रडो, इजूल कामों से दूर रडो, ज़े तुम्हें ईज़ा पडेंयाअे उसे मुआइ कर दो और लोगों के हुकूक की अदाअेगी में जल्ली करो.

(9)..... તુમ્હારા મુસલ્માન ભાઈ બીમાર હો જાએ તો ઉસ કી ઈયાદત કે લિયે જાના ઔર ખાદિમીન કે ઝરીએ ઉસ કી ખબર ગીરી ભી કરતે રહના ઔર જો તુમ્હારી મહફિલ મેં હાઝિર ન હો સકે ઉસ કે હાલાત કા પતા લગાતે રહના, અગર કોઈ તુમ્હારે પાસ આના છોડ દે તો તુમ ફિર ભી ઉસ કે પાસ જાના ન છોડના બલકે ઉસ સે મુલાકાત કરતે રહના, જો તુમ્હારે સાથ બે રુખી સે પેશ આએ તુમ ઉસ સે સિલએ રેહ્મી સે પેશ આના, જો તુમ્હારે પાસ આએ ઉસ કી ઈઝ્જત કરના, જો બુરાઈ સે પેશ આએ ઉસે મુઆફ કર દેના, જો તુમ્હારી બુરાઈ બયાન કરે તુમ ઉસ કી ખૂબિયાં બયાન કરના ઔર ઉન મેં સે કોઈ વફાત પા જાએ તો ઉસ કે હુકૂક પૂરે પૂરે અદા કરના ઔર કિસી કો કોઈ ખુશી હાસિલ હો તો ઉસે મુબારક બાદ દેના, ઔર કોઈ મુસીબત પહોંચે તો ગમ ખ્વારી કરના ઔર અગર કિસી કો કોઈ આફત પહોંચે તો ઉસ સે હમદદી કરના, અગર કોઈ તુમ્હારે પાસ અપની હાજત લાએ તો ઉસ કી હાજત બરારી કરના, કોઈ ફરિયાદ કરે તો ફરિયાદ રસી કરના, કોઈ મદદ કે લિયે પુકારે તો હસ્બે ઈસ્તિતાઅત ઉસ કી મદદ કરના ઔર લોગોં કે સાથ ખૂબ મહબ્બત સે પેશ આના, સલામ કો આમ કરના અગર્યે ઘટિયા લોગોં કો કરના પડે. જબ તુમ્હારી લોગોં કે સાથ કોઈ મહફિલ કાઈમ હો જાએ યા તુમ કિસી મહફિલ મેં ઉન સે મિલો ઔર મસાઈલ મેં બહસ શુરૂઅ કર દેં ઔર ઉન કી રાય તુમ્હારે મૌકિફ કે ખિલાફ હો તો ઉન કે સામને અપના મૌકિફ ઝાહિર ન કરના, ફિર અગર તુમ સે ઉન મસાઈલ કે મુ-તઅલ્લિક સુવાલ કિયા જાએ તો પહલે લોગોં કો વોહ મસ્લક બતાના જિસે વોહ પહલે સે જાનતે હોં, ફિર કહના કે ઈસ મસ્અલે મેં દૂસરા કૌલ ભી હૈ ઔર

वोह येह है और उस की दलील येह है. पस अगर वोह तुम से उस का डल सुनेंगे तो वोह तुम्हारी कद्रो मन्जिलत जानेंगे.

﴿10﴾..... अपने पास डर आने जाने वाले को अेक अैसा मस्अला बता देना जिस में वोह गौरो झिंक करता रहे और लोगों को पेयीदा मसाँल में उलजाने के बज्जअे आसान आम इहम मसाँल बताना, उन से महब्बत से पेश आना और कभी कभी जुश तब्ई ली कर लिया करना, उन से बातचीत ली करते रहना इस से महब्बत ली बढेगी और इल्म के हुसूल पर इस्तिकामत ली रहेगी और कभी कभी उन्हें जाना ली खिला दिया करना और उन की ખताओं को नजर अन्दाज कर देना.

﴿11﴾..... लोगों की ज़रूरत ड़ाजत पूरी करते रहना, उन से नरमी भरतना और दर गुजर करना, किसी के लिये तंगदिली और बेजारी ज़ाहिर न करना, उन के साथ इस तरह धुल मिल जाना गोया तुम उन्ही में से हो और आम लोगों से अैसा मुआ-मला करना जैसा अपने लिये पसन्द करते हो और लोगों के लिये वोही चीज़ पसन्द करना ज़े अपने लिये करते हो, अपने नइस पर काबू पाने के लिये इसे खामियों से बयाना और इस के अहवाल की निगाह दाशत करते रहना, इतना व इसाद अंगेज़ी न करना, ज़े तुम से नाराज हो ज़अे तुम उस से बेजार न होना और ज़े तुम्हारी बात पूरी तवज्जोह से सुने तुम ली उस की बात गौर से सुनना.

﴿12﴾..... लोग तुम्हें जिस काम की तकलीफ़ न दें तुम ली उन्हें उस काम की तकलीफ़ न दो और वोह अपने लिये जिस डालत पर राजी हों तुम ली उन के लिये उस डालत पर राजी हो ज़ओ.

﴿13﴾..... लोगों के मु-तअद्लिक हुस्ने निय्यत को मुकदम रखना,

सख्याई ईप्तिहार करना और तक़्बुर को अेक तरफ़ फ़ेंक देना, धोका देही से बचना अगर्चे वोह तुम्हें धोका दें, लोगों की अमानतें पूरी पूरी अदा करना अगर्चे वोह तुम्हारे साथ बियानत करें, वा'दा वफ़ाई और दोस्ती को पूरा करना, तक्वा ईप्तिहार करना और दीगर मज़ाहिब के लोगों से उन के मज़हब के मुताबिक सुलूक करना.

(आबिर में उज़रते सय्यिदुना ११मा॒मे आ'उम अबू उनी॒झा رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ने इरमाया :)

«14»..... “अगर तुम मेरी १स वसि॒यत को मज़बूती से थाम लोगे तो मैं तुम्हारी सलामती की उम्मीद रभता हूँ.” फिर इरमाया : “तुम्हारी जुदाई मुजे गमजदा कर देगी, तुम्हारी पडयान मुजे तन्हाई में उन्स देती थी, अब ब जरीअमे भत व किताभत मुज से राबिता भर करार रभना. तुम जैसे डो जओ गोया तुम मेरे बेटे और मैं तुम्हारा बाप.”

(مناقبِ امامِ اعظم، الجزء الثاني، شروع في الوصية ليوסף بن خالد السمتي رضى الله عنه، ص ۱۰۶ تا ۱۰۹)

(3)... **हज़रते हम्माद** رَحْمَةُ اللهِ عَلَيْهِ **की नसीहतें**

(हज़रते सय्यिदुना ११मा॒मे आ'उम رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ने अपने साहिब जादे हज़रते सय्यिदुना हम्माद عليه رَحْمَةُ اللهِ عَلَيْهِ को नसीहत करते हुअे इरमाया :) अै मेरे बेटे ! अद्लाह तुजे लिदायत दे और तेरी मदद इरमाअे. मैं तुजे यन्द् बातों की नसीहत करता हूँ, अगर तुम ने ईन्हें याद रभा और ईन पर अमल किया तो मुजे उम्मीद है के दुन्या व आबिरत में सआदत मन्द् रडोगे . (اِنْ شَاءَ اللهُ عَزَّوَجَلَّ)

«1»..... पडली बात येह है के “तक्वा यूँ ईप्तिहार करना के अद्लाह

﴿1﴾..... سے ڈرتے ہوئے اپنے آپ کو گناہوں سے بچانا اور جالی-سکن
 (س کی بندگی کرتے ہوئے اس کے احکام پر پوری تامل کرنا۔

﴿2﴾..... جس چیز کے جاننے کی تمہیں اجازت ہو (اس کے جاننے سے جالیل نہ کرنا۔

﴿3﴾..... اپنی کسی دینی یا دنیوی حاجت کے بیغیر کسی سے
 تاملکاٹ کا اہم نہ کرنا۔

﴿4﴾..... اپنی اٹ سے دوسروں کو ہنسنا ڈھیلانا اور بیغیر مہربانی
 کے کسی سے اپنی اٹ کے لیے ہنسنا ڈھیلنا نہ کرنا۔

﴿5﴾..... کسی مسلمان یا اہل سنت سے دشمنی نہ کرنا۔

﴿6﴾..... اہل سنت کی اٹ کا مال و اہل سنت پر کناہٹ
 ہتھیار کرنا۔

﴿7﴾..... اپنے پاس مہربان مال میں ہونے سے ڈرتے (یا'نی کھلیات
 شہری) سے کام لینا اور لوگوں سے بے نیازی ہو جانا۔

﴿8﴾..... اپنے اوپر لوگوں کی نکتہ کو کمتر بھال نہ کرنا۔

﴿9﴾..... کھلیات سے اپنے آپ کو بچانا۔

﴿10﴾..... لوگوں سے ملامت کرتے وقت سلام میں ہل نہ کرنا،
 ہوش اہلیکی سے گھٹ-گھٹ کرنا، اہل سنت سے اہل سنت سے ہل نہ کرنا
 کرتے ہوئے ملامت کرنا اور بھروسے سے اہل سنت کا ہتھیار کرنا۔

﴿11﴾..... اہل سنت اور اہل سنت سے سلام کی کھلیات کرنا۔

﴿1﴾..... اہل سنت سے سلام کرتے ہیں جس کے جان و مال کی کھلیات کا ہتھیار ہے
 اہل سنت کے ہتھیار سے اہل سنت سے سلام کرنا ہے۔ (غزوی فیض الرسول، ج ۱ ص ۱۰۱)۔
 اہل سنت سے سلام کرنا ہے۔ (غزوی فیض الرسول، ج ۱ ص ۱۰۱)۔
 اہل سنت سے سلام کرنا ہے۔ (غزوی فیض الرسول، ج ۱ ص ۱۰۱)۔
 اہل سنت سے سلام کرنا ہے۔ (غزوی فیض الرسول، ج ۱ ص ۱۰۱)۔

(اہل سنت سے سلام کرنا، ج ۱ ص ۱۰۱)۔

दुआअे सय्यिदुल ॆस्तिग्फ़ार और उस की इजीलत :

(12)..... दुआअे सय्यिदुल ॆस्तिग्फ़ार में मशगूल रहना और वोह येह है :

”اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَىٰ عَهْدِكَ
 وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوؤُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ
 وَأَبُوؤُ بِذَنْبِي فَاغْفِرْ لِي فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ.“

या'नी अै अल्लाह ॆख़् ! तू ही मेरा रब है, तेरे सिवा कोॆ मा'बूद नहीं, तूने मुझे पैदा इरमाया और मैं तेरा बन्दा हूँ और जहां तक हो सका तेरे अहदो पैमान पर काॆम हूँ, अपने गुनाहों के शर से तेरी पनाह मांगता हूँ, तेरी अता कर्दा ने'मतों का ॆकरार करता हूँ और अपनी षताओं का अे'तिराइ करता हूँ. मेरी मग़ि़रत इरमा, गुनाहों को बऱ्शने वाला तेरे सिवा कोॆ नहीं.

ॆस की इजीलत येह है के जो शऱ्स ॆन कलिमात को शाम के वक्त पढे इर उसी रात मर जाअे तो जन्नत में जाअेगा और सुबह को पढे इर उसी दिन मर जाअे तो जन्नत में दाखिल होगा.

(صحيح البخارى، كتاب الدعوات، باب مايقول اذا اصبح، الحديث ٦٣٢٣، ص ٥٣٢)

मुसीबत से बयने का वजीइा :

उरते सय्यिदुना अबू दरदा رضى الله تعالى عنه से कहा गया :

”आप رضى الله تعالى عنه का घर जल गया है.” तो आप رضى الله تعالى عنه ने इरमाया : ”ॆन कलिमात की ब-र-कत से नहीं जल सकता जो मैं ने

नबिय्ये मुकर्रम, नूरे मुजस्सम, रसूले अकरम, शह-शाहे बनी आदम

«13»..... रोजाना पाबन्दी के साथ कुरआने मज्द, इरकाने हमीद की तिलावत करना और इस का सवाब हुजूर नबिय्ये करीम, रज़िज़ुर्रहीम صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ, अपने वालिदैन, असातिअजे किराम और तमाम मुसल्मानों को पढोंयाना.

«14»..... अपने दुश्मनों से ज़ियादा दोस्तों के शर से बचना इस लिये के लोगों की आदात में ब कसरत भराबियां वाकेअ हो गई हैं, अब तुम्हारे दुश्मन तुम्हारे दोस्तों के जरीअे से ही तुम्हें नुकसान पढोंया सकते हैं.

«15»..... अपना राज, मालो दौलत, (इप्तिवाफ़े राय की सूरत में) अपना मौक़िफ़ और आने जाने के अवकात को लोगों से पोशीदा रभना.

«16»..... अपने पडोसियों के साथ बलवाई करना और उन की तकालीफ़ पर सभ्र करना.

«17»..... मजहबे मुहज़ज़ब अहले सुन्नत व जमाअत पर मजहबूती से कार बन्द रहना, ज़ाहिलों और बद्द मजहबों की सोहबत से इजितनाब करना.

«18»..... अपने तमाम मुआ-मलात में निय्यत अख़री रभना और हर हाल में रिज़के हलाल के लिये कोशां रहना.

पांय लाभ में से पांय अहादीस का इन्तिषाब :

«19»..... इन पांय इरामीने मुस्तज़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ पर अमल करना जिन्हें मैं ने पांय लाभ अहादीस में से मुन्तअब किया है.

(1)..... آ'مال کا داری مءار نیضتوں ٲر ۛ اور ۛر اءک کے لیے وولڈی ۛے جس کی ۛس نے نیضت کی.

(صحیح البخاری، کتاب بدء الوحی، باب کیف کان بدء الوحی..... الخ،
 الحدیث ۱، ص ۱، دارالسلام للنشر والتوزیع الریاض)

(2)..... ۛنسان کے ۛسلام کی ٲوٲی یہ ۛ ہے کہ وولڈ ۛڑوٲل ٲاتے ۛوڈ ۛے.

(جامع الترمذی، ابواب الزهد، باب من حسن اسلام المرء ترکہ ما لایعنیہ،
 الحدیث ۲۳۱۷، ص ۱۸۸۵، دارالسلام للنشر والتوزیع الریاض)

(3)..... توم مے سے کول ۛس وکت تک موٲن نلڈی ۛو سکتا جب تک اٲنے ٲا ۛ کے لیے وولڈی ییٲ ٲسند نہ کرے جو اٲنے لیے کرتا ہے.

(صحیح البخاری، کتاب الایمان، باب من الایمان ان یحب لایحیہ ما یحب لنفسہ، الحدیث ۱۳، ص ۳)

(4)..... بےشک ۛلال وائے ۛے اور ۛرام ٲی وائے ۛے اور ۛن ۛوں کے ۛرمیان مشتبھ ییٲوں ۛے جن کے مو-ت اءدلیک بھوت سے لوگ نلڈی جانے. جو مشتبھ ییٲوں سے بیا ۛس نے اٲنی ۛڑوٲت اور اٲنا ۛن بیا لیا اور جو مشتبھ ییٲوں مے ٲا وولڈ ۛرام مے موٲلا ۛوا. وولڈ ۛس یروالے کی مانند ہے جو یراگاھ کے کریب اٲنا رےوڈ یراتا ہے، ۛس کے یراگاھ مے یرے جانے کا اندےشا ہے. سون لو ! ۛر باءشاھ کی یراگاھ ۛوتی ہے اور اءلاھ ۛو ۛو ۛو کی یراگاھ ۛس کی ۛرام کڈا اشیا ۛے. ٲبرءار !

جیسم مے گوشت کا اءک لوٲا ۛے، جب وولڈ سندر جاے تو سارا

જિસ્મ સંવર જાતા હૈ ઓર જબ વોહ ખરાબ હો જાએ તો સારા જિસ્મ ખરાબ હો જાતા હૈ ઓર વોહ (લોથડા) દિલ હૈ.”

(صحیح البخاری، کتاب الایمان، باب فضل من استبیراً لدينه، الحدیث ۵۲، ص ۶)

(5)..... મુસલ્માન વોહ હૈ જિસ કે હાથ ઓર ઝબાન સે દૂસરે મુસલ્માન મહફૂઝ રહે. (صحیح البخاری، کتاب الایمان، باب المسلم من سلم المسلمون من لسانه ويده، الحدیث ۱، ص ۳)

﴿20﴾..... તન્દુરુસ્તી કી હાલત મેં ખોફ વ ઉમ્મીદ કે દરમિયાન રહના ઓર અલ્લાહ પર હુસ્ને ઝન રખતે હુએ મરના, ઓર કલ્બે સલીમ કે સાથ ઉમ્મીદે મગ્ફિરત કા ગ-લબા હો, બેશક અલ્લાહ બહુત બખ્શને વાલા મેહરબાન હૈ.

(4)....ગૂહ બિન અબી મરયમ رَحْمَةُ اللَّهِ عَلَيْهِ કી ગસીહતે ઓહ્દએ કઝા કે મુ-તઅલ્લિક નસીહતે :

હઝરતે સય્યિદુના નૂહ બિન અબી મરયમ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ફરમાતે હૈ : “મેં હઝરતે સય્યિદુના ઇમામે આ'ઝમ અબૂ હનીફા رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ સે અહાદીસ કે મઆની પૂછા કરતા થા તો આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ અચ્છી તરહ ઉન કી વઝાહત ફરમા દેતે થે. ઇસી તરહ આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ સે પેચીદા મસાઈલ ભી દરયાફત કિયા કરતા થા

ઓર મેરે સુવાલાત આમ તૌર પર કઝા ઓર અહકામ કે મુ-તઅલ્લિક

डोते थे. एक दिन आप ﷺ ने ईशदिह फरमाया : “अै नूह ! तुम कजा का दरवाजा षट-षटाओगे”. युनान्चे, अपने शहर “मर्व” लौटने के यन्ट दिन भा'द कजा की जिम्मादारी मेरे कन्धों पर डाल दी गई. उस वक्त आप ﷺ हुआत थे. मैं ने षत के ङरीअे आप ﷺ को ईस भात से आगाह किया और (मजबूरन ओहदा कबूल करने का) उज़ूर ली लिषा जिस के जवाब में आप ﷺ ने मुजे षत लिषा, उस में फरमाया :

इमामे आ'उम ﷺ का मक्तूब

अबू हनीफ़ा ﷺ की तरफ़ से अबू ईस्मह

(رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ) के नाम :

﴿1﴾..... तुम्हारा षत मुजे मौसूल हुवा और उस में दर्ज तमाम भातों से आगाही हुई. (याद रषो !) तुम्हें अेक बहुत लारी जिम्मादारी सोंपी गई है जिस को पूरा करने से बडे बडे लोग आजिज आ जाते हैं. ईस वक्त तुम्हारी डालत अेक डूबते शप्स की मानिन्ट है, लिडाजा अपने नफ़स के लिये निकलने का रास्ता तलाश करो और तक्वा को अपने ऒपर लाजिम कर लो क्यूंके येह तमाम उमूर को दुरुस्त रषता और आषिरत में नजात पाने और हर मुसीबत से छुटकारा पाने का वसीला है और ईस के ङरीअे तुम अख्ठे अन्जाम को पा लोगे. अदलाह عَزَّ وَجَلَّ हमारे तमाम कामों का अन्जाम अख्ठे फरमाअे और हमें अपनी रिजा वाले कामों की तौफ़ीक अता फरमाअे. (आमीन)

बिल्ला शुभा वोह सुनने वाला, करीब है.

«2»..... એ અબૂ ઈસ્મહ ! યાદ રખો ! ફૈસલોં કે અબ્વાબ બહુત બડા આલિમ હી જાન સકતા હૈ જો ઈસ્મ કે ઉસૂલ યા'ની કુરઆનો હદીસ ઓર ફરામીને સહાબા عَلَيْهِمُ الرِّضْوَان પર અચ્છી નઝર રખતા હો ઓર સાહિબે બસીરત (યા'ની સહીહ રાય વાલા) હોને કે સાથ સાથ ઈસ્લામી અહકામ નાફિઝ કરને કી કુદરત ભી રખતા હો. જબ તુમ્હેં કિસી મસ્અલે મેં ઈશકાલ પૈદા હો તો કુરઆનો સુન્નત ઓર ઈજમાઅ કી તરફ રુજૂઅ કરના અગર ઉસ કા હલ ઈન ઉસૂલ (યા'ની કિતાબ વ સુન્નત ઓર ઈજમાઅ) મેં વાઝેહ તૌર પર મિલ જાએ તો ઉસ પર અમલ કરના ઓર અગર સરા-હતન ન મિલે તો ઉસ કી નઝાઈર તલાશ કર કે ઉન પર ઉસૂલ સે ઈસ્તિદ્દલાલ કરના. ફિર ઉસ રાય પર અમલ કરના જો ઉસૂલ કે ઝિયાદા કરીબ ઓર ઉસ કે ઝિયાદા મુશાબેહ હો. ઓર ઉસ કે મુ-તઅલ્લિક અહલે ઈસ્મ ઓર સાહિબે બસીરત લોગોં સે મશ્વરા ભી કરતે રહના. إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ ઉન મેં એસે લોગ ભી હોંગે જો ફિક્હ મેં એસી સમઝ બૂઝ રખતે હોંગે જો તુમ નહીં રખતે.

«3»..... એ અબૂ ઈસ્મહ ! જબ દોનોં મુખાલિફ ફરીક (યા'ની મુદ્દઈ ઓર મુદ્દઆ અલૈહ) ફૈસલા કરાને તુમ્હારી અદાલત મેં હાઝિર હોં તો કમઝોર ઓર તાકત વર, શરીફ ઓર ઝલીલ કો અપની મજલિસ મેં બિઠાને, ઉન કી બાત સુનને ઓર ઉન સે બાતચીત કરને મેં યકસાં સુલૂક કરના ઓર તુમ્હારી તરફ સે કોઈ એસી બાત ન ઝાહિર હો કે શરીફ આદમી નાહક હોને કે બા વુજૂદ અપની શરાફત કે બલ બૂતે પર તુમ સે ઉમ્મીદ લગા બૈઠે ઓર ઝલીલ અપને ઘટિયા પન કી વજહ સે હક પર

ছোনে কে বা বুজুদ হক কে মুআ-মলে মেন্তু সে মাযুস ছো জাঅে.

«4»..... ঐ অধু ঈস্মহ ! জব ছোনোঁ ঙরীক ঝেঠ জাঅোঁ তো উন্ডেঁ ঈত্মীনান ব সুকুন সে ঝেঠনে ছেনা তাকে উন সে ঝৌঙ ঔর (অছালত মেঁ আনে কী) শরমিন্‌দগী ছুর ছো জাঅে. ঙির উন কে সাথ নরমী ব হমছর্দী কে লছজে মেঁ ঝাতযীত করতে হুঅে উন্ডেঁ অপনী ঝাত সমজানা ঔর উন মেঁ সে হর অেক কী ঝাত পুরী তবজজোহ সে সুননা. জো কুছ বোহ কছনা যাছতে ছোঁ কছনে ছেনা ঔর জব তক বোহ অপনা অপনা মৌকিঙ ন ঝযান কর লেঁ উস বক্ত তক ঙেঁসলা করনে মেঁ জছ্দী ন করনা. লেকিন অগর বোহ ঙুজুল ঝছস মেঁ পরেঁ তো উন্ডেঁ ঈস সে রোক ছেনা ঔর উন্ডেঁ সমজা ছেনা (কে ঈস ঝাত কা অস্ব মুআ-মলে সে কোঈ তঅল্লুক নছী) ঔর ঝেজারী, গুস্সা যা রন্‌জো গম কী ছালত মেঁ ঔর পেশাঝ ঔর ঝুক কী শিছত কে বক্ত ঝী কোঈ ঙেঁসলা ন করনা.

«5»..... উস বক্ত ঙেঁসলা ন করনা জব তুছ্‌ছারা ছিল কিসী ঔর যীজ মেঁ মশ্‌গূল ছো ঝল্‌কে ঔসে বক্ত ঙেঁসলা করনা জব তুছ্‌ছারা ছিল ছীগর ঙিঁকোঁ সে ঝালী ছো.

«6»..... রিশ্‌তেরােঁ মেঁ জুছাঈ কা ঙেঁসলা করনে মেঁ জছ্দী ন করনা ঝল্‌কে উন্ডেঁ ঝার ঝার ঈকছ্‌ছে ঝিঠানা (ঔর উন কে মুআ-মলে কো সুলজানা) শায়ছ ! বোহ আপস মেঁ সুলছ কর লেঁ. ঙির অগর বোহ সুলছ কর লেতে ছেঁ তো ছীক ছেঁ বরনা উন কে ছরমিয়ান ঙেঁসলা কর ছেনা. ঔর কিসী কে ঝিলাঙ উস বক্ত তক ঙেঁসলা ন করনা জব তক পুরী তরছ বোহ যীজোঁ বাজেহ ন ছো জাঅোঁ জো উস পর ঈল্‌জাম সাঝিত করতী ছোঁ.

﴿7﴾..... કિસી ગવાહ કો (કિસી દલીલ કી) તલ્કીન ન કરના, ન મજલિસે કઝા મેં કિસી કો કોઈ ઈશારા કરના ઓર ન હી કઝા કે ઉમૂર અપને કિસી કરાબત દાર કે સિપુદ કરના.

﴿8﴾..... કિસી કી દા'વત કબૂલ ન કરના વરના તુઝે તોહમત લગેગી.

﴿9﴾..... અદાલત મેં કિસી સે (ગૈર ઝરૂરી) બાતચીત ન કરના.

﴿10﴾..... ખૌફે ખુદા વન્દી عَزَّوَجَلَّ કો હર ચીઝ પર ફૌકિયત દેના કે યેહ બાત તુમ્હેં દુન્યા વ આખિરત કે મુઆ-મલાત મેં કાફી હોગી ઓર ઈસ કી બ-ર-કત સે ગલત ફૈસલા કરને સે સલામતી નસીબ હોગી. અલ્લાહ عَزَّوَجَلَّ હમેં ઓર તુમ્હેં પાકીઝા ઝિન્દગી ઓર આખિરત મેં બા ઈઝ્ઝત મકામ અતા ફરમાએ.

(امین بجاه النبی الامین صلی اللہ تعالیٰ علیہ والہ وسلم)

(مناقبِ امامِ اعظم، الجزء الثانی، کتاب الامام الی ابی عصمة نوح بن ابیهریم رحمة الله تعالیٰ علیہ، ص ۱۱۰-۱۱۱)



અકાબિર તલામિઝા કો નસીહતેં

હઝરતે સય્યિદુના ઈમામ અબૂ યૂસુફુ عَلَيْهِ السَّلَامُ બયાન ફરમાતે હેં : “એક દિન બારિશ હો રહી થી, હમ સબ હઝરતે સય્યિદુના ઈમામે આ'ઝમ عِنْدَ اللَّهِ تَعَالَى કે પાસ હાઝિર थे. હાઝિરીન

મં હઝરતે દાવૂદ તાઈ, હઝરતે આફ્રિયા ઔદી, હઝરતે કાસિમ બિન મઅન મસ્ઊદી, હઝરતે હફ્સ બિન ગિયાસ નખઈ, હઝરતે વકીઅ બિન જર્હ, હઝરતે માલિક બિન મગવલ, હઝરતે ઝફર બિન હુઝૈલ
 وَرَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِمْ أَجْمَعِينَ وَغَيْرَا شَامِلِ يه. ” આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ હમારી તરફ મુ-તવજજેહ હુએ ઔર ફરમાયા :

﴿1﴾..... તુમ્હેં દેખ કર મેરા દિલ ખુશ હોતા ઔર ગમ દૂર હોતે હૈં. મૈં ને તુમ્હારે લિયે ફિક્કહ કો ઝીન ઔર લગામ દી હૈ કે જબ યાહો સુવારી કરો ઔર તુમ્હારી ઐસી ઇલ્મી વ અ-મલી તરબિય્યત કી હૈ કે લોગ તુમ્હારી પૈરવી કરેંગે, તુમ્હારે અલ્લાહ તલાશ કરેંગે. મૈં ને લોગોં કી ગરદનેં તુમ્હારે આગે ઝુકા દી હૈં. તુમ મેં સે હર એક કાઝી બનને કી સલાહિય્યત રખતા હૈ ઔર દસ તો ઐસે હૈં કે વોહ કાઝિયોં કી રહનુમાઈ કર સકતે હૈં. મૈં તુમ્હેં અલ્લાહ عَزَّوَجَلَّ ઔર ઉસ કી અતા કદા ઇલ્મી જલાલત કા વાસિતા દેતા હૂં કે ઇલ્મે દીન કો દુન્યવી હુકૂમત ઔર માલો દૌલત કે હુસૂલ કા ઝરીઆ બના કર ઇસ કી કદ્રો કીમત કો કમ ન કર દેના.

કાઝિયોં કે લિયે હિદાયાત :

﴿2﴾..... અગર તુમ મેં સે કિસી પર કઝા કી ઝિમ્માદારી આન પડે ઔર અપને અન્દર કોઈ ઐસી ખામી પાએ જિસે અલ્લાહ عَزَّوَجَلَّ ને લોગોં સે છુપા રખા હો તો ઉસ કા કાઝી બનના ઔર ઇસ કી તન-ખ્વાહ

लेना ज़रूर नहीं और अगर तुम में से किसी को ज़रूरतन काजी बनना पड़े तो अपने और लोगों के दरमियान हिजाब (या'नी रुकावटें) छाड़ल न करे. पांयों नमाज़ें ज़ामेअ मस्जिद में अदा करे और हर नमाज़ के बा'द येह अे'लान करे : "किसी को कोई छाजत हो तो मुज से मुलाकात करे." काजी को याहिये के नमाजे ँशा के बा'द भी तीन मर्तबा येह सदा लगाअे फिर अपने घर ज़अे.

﴿3﴾..... अगर कोई काजी बीमारी की वजह से अपनी जिम्मादारी पूरी न कर सके तो हिसाब लगा कर अपनी तन-प्वाह से उतने दिन की कटौती करवाअे.

﴿4﴾..... अगर ँमाम ने पियानत की या ँसला करने में जुल्म व ज़ियादती का मुर-तकिब हुवा तो उस की ँमामत बातिल (या'नी ખत्म) हो ज़अेगी और उस का ँसला करना ज़रूर न होगा. और अगर वोह अे'लानिया गुनाह का मुर-तकिब हो तो उस से करीब तरीन काजी उस पर हद ज़री करे.



تَمَّتْ بِالْخَيْرِ